

જનસંપર્ક અધીકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩
કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૩/૦૭/૨૦૧૮ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૨૯/૧૮

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૩૪ કેસ કરી, ૩૧ વ્યક્તિઓને ઝડપી, ૧૬૨ લીટર દેશી દારૂ, ૧૦૮ બોટલ ઇંગ્લીશ દારૂ, ૨૯ બિયર ટીન અને ૧ સ્કૂટર કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૧ કેસ કરી ૫ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૦૮૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૩૦/૧૮

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૫૩ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૩૩૧/૧૮

માધવપુરા : મહેન્દ્રકુમાર ખોડીદાસ પટેલ (ઉ.વ.૬૭)(રહે,અંજની એપાર્ટમેન્ટ રામજી મંદિરની પાસે ઈન્ડીયા કોલોની, ઠક્કરબાપાનગર રોડ) એ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૭/૧૮ બપોરના ૦૨/૦૦ થી ૨/૪૫ વાગ્યા દરમિયાન સત્તાધાર ચાર રસ્તા થી દિલ્હી દરવાજા BRTS બસ સ્ટેન્ડ સુધી ની બસ રૂટ નં-૬૬/૩ માં મુસાફરી દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ ભીડનો લાભ લઈ નજર ચુકવી, મહેન્દ્રકુમાર ના ખિસ્સામા મુકેલ રોકડા રૂપિયા ૬૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.પી.ચાવડા ચલાવે છે.

દરીયાપુર : વિજયભાઈ જમીયતરાય વિઠાણી (ઉ.વ.૫૭)(રહે, નેત્ર બંડોઝ સહજાનંગ ફ્લેટની પાછળ મેમનગર) એ દરીયાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૧/૭/૧૮ રાતના ૮/૦૦ વાગ્યાના સુમારે કાલુપુર ફુટ માર્કેટ માં જગદીશ ફુટ માર્કેટ નામની દુકાન નજીક રોડ ઉપર પાર્ક કરેલ પોતાની એક્ટીવાની ડેકીનું લોક ખોલી, અજાણી વ્યક્તિ ડેકીમાંથી કાળા પર્સમાં રાખેલ આશરે રોકડ રૂપિયા ૩,૦૦,૦૦૦/- ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી વી.એ.રાણા ચલાવે છે.

નિકોલ : મનસુખભાઇ રૂપાભાઇ ઝાલા (રહે,અરજણબાપાની ગલી ભવાનીચોક મ્યુ.સ્કુલ પાસે ઠક્કરનગર) એ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૭/૧૮ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે વિરાટનગર થી આગળ આવેલ રંજન સ્કુલ સામે રોડ ઉપર મનસુખભાઇ મોટર સાયકલ પાછળ પત્નીને બેસાડી પસાર થઇ રહ્યા હતા દરમ્યાન એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરુષ (૨૫ થી ૩૦ વર્ષના આશરના) મનસુખભાઇની પત્નીના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેંચી તોડી લઇ ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.એન.શર્મા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.